

**Dev Information Technology Limited**

Reg. Office: 14, Aaryans Corporate Park, Near Shilaj Railway Crossing,  
Thaltej-Shilaj Road, Thaltej, Ahmedabad - 380 059. (INDIA)  
Phone: +91 94298 99852 / 53

www.devitpl.com | info@devitpl.com

Offices: Gujarat | Maharashtra | Rajasthan | Canada  
CIN: L30000GJ1997PLC033479



**Date: August 09, 2025**

<b>To,</b> <b>The Manager-Listing Department,</b> <b>The National Stock Exchange of India Limited,</b> Exchange Plaza, Plot No. C/1, G-Block, Bandra Kurla complex, Bandra East, Mumbai-400 051 Trading Symbol: DEVIT	<b>To,</b> <b>The Secretary,</b> <b>BSE Limited</b> Phiroze Jejeebhoy Towers, Dalal Street Mumbai -400001  Trading Symbol: 543462
--	--

**Sub: Newspaper advertisement for Un-audited Financial Results for the quarter ended on June, 2025**  
**Ref.: Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

With reference to the captioned subject and pursuant to Regulation 47 & 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we, Dev Information Technology Limited (the "Company") are submitting herewith enclosed copy of newspaper cutting regarding the information published for members of un-audited Financial results for the First quarter ended on June, 2025 in today's Business Standard English edition, Ahmadabad and Jai Hind, Gujarati edition (Vernacular Language), Ahmadabad, dated August 09, 2025.


This is for your information and record.

Thanking you,

**Yours faithfully,**  
**For Dev Information Technology Limited**

**Krisa Shah**  
**(Company Secretary & Compliance Officer)**  
**Place: Ahmedabad**  
**Encl: a/a**

GUJARAT GRAMIN BANK REGIONAL OFFICE, SURAT		NOTICE UNDER SECTION	
Palod Branch		13(2) OF SARFAESI ACT 2002	
DEMAND NOTICE U/S 13(2) OF SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002.			
A notice is hereby given that the following Borrowers and Co-borrowers have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). The notices were issued to them under Section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their last known addresses, but they have been returned unserved and as such they are hereby informed by way of this public notice.			
Name of the Borrower & Nature & type of Facility	Security Agreement with brief description of property	Limit (Rs.)	Amount outstanding
Mr. Pravinbhai Kalidas Patel Plot No 11, Nilkant Residency, Near Tapovan School, Moje: Mulad, Tal -Olpad Road, Surat.	All that piece and parcel of immovable property i.e. Plot No. 11(A-1) (As per Form No 7 & 12, Block No. 297/A/2-11) admeasuring area 74.35 sq. mtrs. In the common roads and COP (aggregating 115.91 sq. mtrs.) of 'Nilkanth Residency' of the land bearing block No. 297 A/2 paiki of Moje; Village: Mulad, Taluka:Olpad , District , Surat. Its bounded as: East : Adj. Property, West : Adj. Block No. 297/A/1, North :Adj. Plot No. 12 (A-1), South :Adj. Plot No. 10 (A-2)	Rs. 20.00 Lakhs	Rs. 16,37,202.33 +interest +charges as on 30.07.2025
		Rate of Interest 8.90% P.A	
		Date of Notice 30.07.2025	
		Date of NPA 28.07.2025	
Mrs Kokilaben Pravinbahi Patel Plot No 11, Nilkant Residency, Near Tapovan School, Moje: Mulad, Tal -Olpad Road, Surat. Housing Loan: 3170060000103			
The steps are being taken for substituted service of notice. The above Borrower(s) and /or their Guarantor(s) (whenever applicable) are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of Section 13 of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security interest Act, 2002.			
Date: 09.08.2025 - Place: Surat		Authorized Officer, Gujarat Gramin Bank, Regional Office-Surat	

DEV INFORMATION TECHNOLOGY LIMITED									
CIN : L30000GJ1997PLC033479 Registered Office : 14, Aaryans Corporate Park, Nr. Shilaj Railway Crossing, Thaltej, Ahmedabad, Gujarat - 380059    Email : cs@devitpl.com    Website : https://www.devitpl.com    Ph: +91-94298 99852 / 53									
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025									
		Standalone				Consolidated			
Sr. No	Particulars	Quarter ended on 30/06/2025 (Unaudited)	Quarter ended on 31/03/2025 (Audited)	Quarter ended on 30/06/2024 (Unaudited)	Year ended on 31/03/2025 (Audited)	Quarter ended on 30/06/2025 (Unaudited)	Quarter ended on 31/03/2025 (Audited)	Quarter ended on 30/06/2024 (Unaudited)	Year ended on 31/03/2025 (Audited)
1	Total Income from Operations	3568.87	4618.41	3044.58	16332.33	4345.91	5178.38	3573.00	18390.89
2	Net Profit for the period (before tax, exceptional and /or extraordinary items)	239.87	117.29	421.20	1873.34	278.03	161.80	478.76	1807.94
3	Net Profit for the period before tax (after exceptional and /or extraordinary items)#	239.87	117.29	421.20	1873.34	278.03	161.80	478.76	1807.94
4	Net Profit for the period after tax (after exceptional and /or extraordinary items)	175.24	87.12	331.15	1542.04	218.17	113.45	371.75	1477.97
5	Total Comprehensive income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax)]	174.14	88.62	327.76	1533.42	221.29	119.10	369.39	1472.17
6	Paid-up Equity Share Capital (face value of Rs.05/- each)	1126.70	1126.70	1124.23	1126.70	1126.70	1126.70	1124.23	1126.70
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	—	—	—	5973.95	—	—	—	5735.46
8	Earnings Per Share (face value of Rs. 05/- each) (for continuing and discontinued operations)								
1) Basic		0.78	0.38	1.47	6.85	0.94	0.54	1.56	6.61
2) Diluted		0.78	0.37	1.47	6.84	0.93	0.53	1.55	6.60
Notes :									
(1) The above is an extract of the detailed format of Quarter ended Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended Financial Results are available on the websites of the National Stock Exchange of India at www.nseindia.com and Bombay Stock Exchange at www.bseindia.com and on the website of the Company at the www.devitpl.com.									
(2) The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on August 08, 2025.									
(3) The Limited Review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.									
(4) The financial results for the Quarter ended June 30, 2025 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.									
For and on behalf of Board of Directors of Dev Information Technology Limited									
Date : 08/08/2025 Place : Ahmedabad		sd/- <b>Pranav Pandya</b> Chairman - DIN : 00021744							
									

## Aadhar Housing Finance Ltd.

**Corporate Office:** Unit No.802, Natraj Rustomjee, Western Express Highway and M.V.Road, Andheri (East), Mumbai-400069  
**Nadiad Branch:** Shop no.04,1st Floor,Prime Square, Khasra No-R.S.NO:1154/A, Near Canal and DDIT University,College Road, Nadiad, dist-Kheda,Guj-387001  
**Surat Branch:** Office No. 209 & 210 , 2nd Floor , Universal Business Center, Near Madhuvan Circle, L.P. Savani Road, Adajan, Surat-395009 GJ  
**Himmatnagar Branch:** Office No. 213/A, 2nd Floor, Sum Complex 2, Motipura, P.O. Himmatnagar, Dist. Sabarkantha - 383001 (Gujarat)  
**Rajkot Branch:** office number 204 to 208, 2nd Floor, The Imperia, off. Shubhas road, CWS No 14, CS no 3085, Opp: Shashtri maidan, Panchnath Plot, Rajkot, Gujarat – 360001

### E- AUCTION – SALE NOTICE

E-Auction Sale Notice for Sale of immovable Properties under the Securitization and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of Security Interest (Enforcement) Rules, 2002.  
Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged, possession of which has been taken by the Authorised Officer of **Aadhar Housing Finance Limited** will be sold on “**As is where is**”, “**As is what is**”, and “**Whatever there is**” with no known encumbrances Particulars of which are given below:

Sl No.	Borrower(s) / Co-Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date & Amount	Description of the Immovable property	Reserve Price (RP)	EMD (10% of RP)	Nature of possession
1	(Loan Code No. 03900000675/ Nadiad Branch) Hirenkumar Ranchhodhbhai Vasava (Borrower) Ranchhidbhai I Vasava (Co-Borrower)	<b>13-05-2024 &amp; ₹ 19,74,828/-</b>	All that part & parcel of property bearing, R S No 356 Pakki 02 Labh Bungalow Open Plot No 44 Khangi Plot No B 17 Labh Bungalow Near Mahadev Mandir Kathal Chokadi Ahemdavad Road, Kheda, Guj., -387630 <b>Boundaries</b> : East: Margin space after Society common Road, West: Plot No. 17, North: Open Agriculture Land / open plot RS No. 35, South: Plot No. 43	<b>Rs. 15,40,080/-</b>	<b>Rs. 1,54,008/-</b>	<b>Physical</b>
2	(Loan Code No. 04200001845/ Surat Branch) Mitalben Dhavalbhai Kakadiya (Borrower) Dhavalkumar Dilipbhai Kakadiya (Co-Borrower), Ghanshyambhai K Mangukiya (Guarantor)	<b>10-02-2025 &amp; ₹ 6,22,052/-</b>	All that part & parcel of property bearing, R S No 102 Block No 104 Flat No B 407 4Th Floor Vatchhraj Res Building No B Anmol Residency 2 B H Aradhana Industrial Estat , Surat , Gujarat , 394305, <b>Boundaries</b> : East: Passage & Flat No. B/404, West: Garden, North: Flat No. B/406, South: Flat no. B/408	<b>Rs. 2,71,800/-</b>	<b>Rs. 27,180/-</b>	<b>Physical</b>
3	(Loan Code No. 03610000058/ Himmatnagar Branch) Jakirhusen Abbasmiya Shekh (Borrower) Abbasmiya Misrimiya Shekh & Nurjaha Abbasmiya Shekh (Co-Borrowers)	<b>10-04-2024 &amp; ₹ 10,19,814/-</b>	All that part & parcel of property bearing, Gf Only Ashiyana Society Khifayatnagar Area, Savgadha Na Plot No. 23 P North Side Himatnagar Sabar Kantha Gujarat 383220 <b>Boundaries</b> : East: AS Per Plan Plot No.24, West: 9.00 MT Road, North: Rs No 979, South: AS Per Plan Plot No.23p Land	<b>Rs. 5,99,040/-</b>	<b>Rs. 59,904/-</b>	<b>Physical</b>
4	(Loan Code No. 04010000310/ Rajkot Branch) Khimijibhai Dangar (Borrower) Muktaben Khimabhai Dangar (Co-Borrower)	<b>13-05-2024 &amp; ₹ 8,23,844/-</b>	All that part & parcel of property bearing, House No. 184 Off. Khorasa Road Khorasa Junagadh Guj. 362215 <b>Boundaries</b> : East: Karanbhai Hamirbhai House After Road, West: Parbatbhai Chaganbhai Nu Khetar, North: Karanbhai Hamirbhai House After Road, South: Memanbhai Khimabhai Nu Khetar	<b>Rs. 1,95,300/-</b>	<b>Rs. 19,530/-</b>	<b>Physical</b>

- Last Date of Submission of DD of Earnest Money Deposit along with KYC, Tender Form and accepted Terms and conditions (Tender Documents) is **28-08-2025 within 5:00 PM** at the Branch Office address mentioned herein above or uploaded on <https://bankeauctions.com>. Tenders documents received beyond last date will be considered as invalid tender and shall accordingly be rejected. No interest shall be paid on the EMD.
- Date of Opening of the Bid/Offer (Auction Date) for Property is **29-08-2025 on https://bankeauctions.com at 3:00 PM to 4:00 PM**.
- AHFL is not responsible for any liabilities whatsoever pending upon the property as mentioned above. The Property shall be auctioned on '**As is Where Is Basis**', '**As is What Is Basis**' and '**Whatever Is There Is Basis**'.
- The Demand Draft Should be made in favor of 'Aadhar Housing Finance Limited' Only.
- Auction/bidding shall be only through "Online Electronic Bidding" through the website <https://bankeauctions.com>. Bidders are advised to go through the website for detailed terms before taking part in the e-auction sale proceedings.
- The intending bidders should register their names at portal **M/s C 1 INDIA PVT LTD** through the link <https://bankeauctions.com/registration/signup>, and get their User ID and password free of cost. Prospective bidder may avail online training on E- auction from the service provider **M/s C 1 INDIA PVT LTD** through the website <https://bankeauctions.com>
- For further details contact Authorised Officer of **Aadhar Housing Finance Limited, Amitkumar Soni, Contact No. 9913333214, Islauddin, Contact No. 9001292206, Vishvarajsinh Prakashsinh Chudasama, Contact No. 9879530096**, OR the service provider **M/s C 1 INDIA PVT LTD, Mr. Prabhakaran, Mobile No: +91-74182-81709, E-mail:tm@c1india.com & support@bankeauctions.com, Phone No. +917291981124 /25 /26**. As on date, there is no order restraining and/or court injunction AHFL/the authorized Officer of AHFL from selling, alienating and/or disposing of the above immovable properties/ secured assets.
- For detailed terms and conditions of the sale, please refer to the link provided in Aadhar Housing Finance Limited (AHFL), secured creditor's website i.e. [www.aadharhousing.com](http://www.aadharhousing.com).
- The Bid incremental amount for auction is **Rs.10,000/-**.
- This newspaper publication and the data contained herein is intended for general public dissemination. Any reproduction, distribution, transmission, or republication of this content, in whole or in part, in any form or by any means, whether print, digital, electronic publication in any form, e-mail or web publications, or otherwise through any mode is strictly prohibited. Any unauthorized use of the above content through any mode may result in appropriate legal action by AHFL.

Place : Gujarat  
Date : 09.08.2025

Sd/- Authorised Officer  
Aadhar Housing Finance Limited

**PUBLIC NOTICE INTIMATION OF ENVIRONMENTAL CLEARANCE**

It is hereby informed that the State Level Environmental Impact Assessment Authority (SEIAA), Parvavaran Bhavan, Sector 10-A, Gandhinagar-382 010, has accorded Environmental Clearance for expansion of manufacturing plant for 'Synthetic Organic Chemicals' at Plot No. Z/103/F/1 & 2, SEZ Dahaj, Part-II Tal: Vagra, Dist: Bharuch-392130, Gujarat of **M/s. Tatva Chintan Pharma Chem Limited** vide EC letter No. SEAC/GJ/IND3/525510/11204/2025 & EC Identification No. EC2582412G/J5162905N dated 21<sup>st</sup> July, 2025 under the provision of EIA Notification dated 14<sup>th</sup> September 2006.

Copies of Clearance letter are available on website of <http://parivesh.nic.in/>.

**Authorized Signatory**  
**Tatva Chintan Pharma Chem Limited**

**बैंक ऑफ बड़ोरा**  
**Bank of Baroda**

**BANK OF BARODA - SAYAJIGUNJ BRANCH**

Yash Kamal, Lok Manyu Tilak Road,  
Sayajigunj, Vadodara-390005. Ph: 0265-2361893.  
Email: sayajji@bankofbaroda.com

**APPENDIX -IV [Rule 8(1)] POSSESSION NOTICE (Immovable Property)**

The undersigned being the Authorized Officer of the **Bank of Baroda** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with (Rule-8) the Security Interest (Enforcement) Rules, 2002, issued a **Demand Notice dated 30-11-2024** calling upon the Borrowers/Guarantor/Mortgagor **M/s Sawaria Trading Company Prop. Mr. Ankit Laddha & Guarantor- Mr. Satyanarayan Madanlal Laddha** to repay the amount mentioned in the notice being **Rs. 3,22,15,082.80 (Rupees Three Crore Twenty-Two Lakh Fifteen Thousand Eighty-Two and Paisa Eighty Only)** as on **30-11-2024** with further interest and expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The Borrowers/Guarantor/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this **3rd day of August of the year 2025**.

The Borrowers/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of Baroda** for an amount of **Rs. 3,22,15,082.80 (Rupees Three Crore Twenty-Two Lakh Fifteen Thousand Eighty-Two and Paisa Eighty Only)** as on **30-11-2024** and interest plus other charges thereon.


The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF IMMOVABLE PROPERTY**

All that part & parcel of the equitable mortgaged of Block No. C-58 "Yogiraj Township" Near Narayan Vidyalaya, admeasuring area 1137.87 Sq Ft at Waghodia Road, Majie Danteshwar in the Registration Sub-District and District Vadodara and bounded by: East: Block No. C-59, West: F.P. No. 1061, North : Block No. C-67, South : 7.5 Mtrs Internal Road.

**Date: 03.08.2025**  
**Place: Vadodara**

**Authorised Officer**  
**Bank of Baroda**

**बैंक ऑफ बड़ोरा**  
**Bank of Baroda**

**APMC Dumbhal Branch:** Near Kiran Motors, Puna Kumbharia Road,Dumbhal,Surat-395010, India. Ph :- 2333577, 2363577  
Email:dumsur@bankofbaroda.com

**ANNEXURE – REDEMPTION NOTICE**

**Notice under Rule 6(2) and/or Rule 8(6) of the Security Interest (Enforcement) Rules,2002**

**1. MR. MANOJKUMAR BHAGAVAN SAMAL**  
**2. MRS. MANULATA BHAGAVAN SAMAL**  
Flat No.405, Building No.B-6, Swapna Shrushti Residency, Bhestan, Surat.

**Re: Notice under Rule 6(2) and/or Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act, 2002).**

Ref :- 1. Demand Notice dated **17.12.2024** issued u/s 13 (2) of the SARFAESI Act 2002.  
2. Possession Notice dated **13.03.2025** issued u/s 13 (4) of SARFAESI Act 2002.

**Dear Sir/Madam,**

Whereas the Authorized Officer of the **Bank of Baroda**, Branch **APMC Dumbhal** being Secured Creditor Bank in exercise of the powers conferred u/s 13(2) of the SARFAESI Act 2002 (hereinafter referred as "Act") read with Rules 3 of Security Interest (Enforcement) Rules 2002 (hereinafter referred as "Rules") issued demand notice dated **17.12.2024** calling upon you being Borrowers (s)/ Mortgagor (s) / Guarantor (s) to repay the amount stated in the said demand notice within 60 days from receipt of said notice.

And whereas you have failed to repay the amount, the undersigned in exercise of the powers conferred u/s 13(4) of the said Act read with Rule 4 and/or Rule 8 of the Rules have taken over the Possession of Secured Assets (hereinafter referred as the said properties) more particularly described herein below Schedule. [Copy of Possession Notice dated **13.03.2025** is attached herewith for ready reference]

Even after taking possession of the secured asset, you have not paid the amount due to Bank as mentioned in above Possession Notice. Your attention is invited to the provisions of sub-section (8) of Section 13 of SARFAESI Act, 2002 in respect of time available, to redeem the secured assets.

Therefore you all are requested to pay the dues as mentioned in possession notice along with applicable interest, cost, charges & expenses within 30 days from receipt of this notice and redeem the secured asset as mentioned below. In case you fail to pay the above mentioned dues & redeem the secured asset within 30 days from receipt of this notice, Bank will be constrained to sell the secured asset through public e-Auction by publication of e-Auction Sale notice. The date, time of e-auction and Reserve Price of the property shall be informed to you separately.

**Schedule of Secured Assets/Properties**

S r. No.	Description of the Movable/Immovable Properties	Date of Possession	Type of Possession Symbolic/Physical	Date of Publication of Possession Notice for Immovable property only)
1.	All Piece And Parcel In Immovable Property Bearing Flat No. 405, Building No. B-6, 4th Floor, Swapna Shrushti Residency Opp. Sundaram Status, Bhestan, Surat.	13.03.2025	Symbolic	17.03.2025

**Date :21. 07. 2025 | Place: Surat**  
**Authorized Officer Bank of Baroda,APMC Dumbhal Branch**

## Rapicut Carbides Limited

Regd. office : 119, GIDC Industrial Area, Ankleshwar - 393002 Gujarat  
Tele : 7573022016/7622002203 CIN : L28910GJ1977PLC002998  
Email : [investors@rapicutcarbides.com](mailto:investors@rapicutcarbides.com) Website : [www.rapicutcarbides.com](http://www.rapicutcarbides.com)

### EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER ENDED 30TH JUNE, 2025


Particulars	Quarter ended		Year ended 31-03-2025 (Audited)
	30-06-2025 (Unaudited)	30-06-2024 (Unaudited)	
1. Total income from operations	1037.71	1088.86	4198.64
2. Net Profit(+) / Loss(-) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(140.73)	(55.40)	(224.79)
3. Net Profit(+) / Loss(-) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(140.73)	(55.40)	(224.79)
4. Net Profit(+) / (Loss) (-) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(141.06)	(57.43)	(232.58)
5. Total Comprehensive income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) & other Comprehensive Income (after tax)	(141.55)	(58.17)	(231.86)
6. Equity Share Capital	537.12	537.12	537.12
7. Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.			1421.15
8. Earnings Per Share (of Rs.10/- each) (for continuing & discontinued operations)			
(a) Basic:	(2.63)	(1.07)	(4.33)
(b) Diluted:	(2.63)	(1.07)	(4.33)

- NOTES:-**
- The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Results is available on the below mentioned website:-  
Company's Website : <http://www.rapicutcarbides.com/finance.htm> and BSE Limited :- [www.bseindia.com](http://www.bseindia.com). The same can also be accessed by scanning of the Quick Response Code (QR) Code provided below.
  - The above Unaudited Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards specified under Section 133 of the Companies Act, 2013.
  - The above Unaudited Financial Results have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on 07th August, 2025.
  - The financial results for the quarter ended on 30th June, 2025, have been review by the Statutory Auditors as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended.
  - The Company has only one reportable primary business segment as per Ind AS 108 i.e. Tungsten Carbide Products.
  - Figures of previous periods have been regrouped to conform to the figures of the current period.

Date : August 07, 2025  
Place : Ankleshwar



For and on behalf of the Board of  
**RAPICUT CARBIDES LIMITED**  
Abhishek V. Gami  
(Managing Director)  
(DIN : 07570948)

**यूको बैंक**  
**UCO Bank**  
(अवकाश सहकारी संस्था)

**Ajwa Road Branch, Dudheshwar Nagar Pani Ni Tanki**  
**Ajwa Road, Vadodara - 390019.**  
Ph: 0265-2512131, Email ID: [ajward@ucobank.co.in](mailto:ajward@ucobank.co.in)

**Appendix - IV [See Rule 8(1)]**  
**POSSESSION NOTICE (for Immovable Property)**

Whereas, The undersigned being the authorized officer of **UCO Bank, Ajwa Road Branch, Arunoday Complex, Near Dudheshwar Complex, Vadodara - 390019** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **09.05.2025** calling upon the **Borrower Mr. Nikunj Jyavantilal Barot Co-Borrower Mrs. Dhruvi Nikunj Barot** to repay the amount mentioned in the notice being **Rs. 13,73,255.28 (Rupees Thirteen Lakh Seventy Three Thousand Two Hundred Fifty Five and Paise Twenty Eight Only)** within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has **taken possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the **08<sup>th</sup> day of August of the year 2025**.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **UCO Bank, Ajwa Road Branch** for an amount **Rs. 13,73,255.28** and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Immovable Property**

Equitable Mortgage of Flat an admeasuring area of 900 Sq. Ft. bearing R.S. No. 401, City Survey No. 855 and Plot No. A/174 to 181, in the scheme known as "HARISAI SHARINAM" Apartment Tower-A, Flat No. 505 on Fifth Floor, situated Vibhag-2 in Danteshwar, Vadodara, in the Registration District and Sub District Vadodara, within SRO Vadodara-2 (Danteshwar). The Property bounded as under : East : Tower-B, West : Flat No.506, North : Dharsanam Bunglow, South : Flat No. 504.

**Date : 08/08/2025**  
**Place : Vadodara**

**Authorized Officer,**  
**UCO Bank.**

**I SECURE CREDIT & CAPITAL SERVICES LIMITED**

CIN : L18209WB1994PLC062173  
Regd. Office : Old Nimta Road, Nandan Nagar, Belghoria, Kolkata-700083, WB, India  
Admin. Office : First Floor, Hall No-2, M R Icon, Next To Milestone Vasna Bhayli Road, Vadodara-391410, Gujarat  
Corp. Office : 1st Floor, City Castle Building East Fort, Thrissur 5, Pin : 680005, Kerala.  
Email : [compliance@iccslimited.in](mailto:compliance@iccslimited.in) / Website : [www.orchidsecureltd.com](http://www.orchidsecureltd.com)  
Tel No. : +91 7574895589

**Extract of Standalone Unaudited financial result for the Quarter ended 30th June, 2025**  
(₹. in Lakhs)

Sl. No.	Particulars	Standalone			
		Quarter Ended 30-06-2025 (Unaudited)	Quarter Ended 31-03-2025 (Audited)	Quarter Ended 30-06-2024 (Unaudited)	Year Ended 31-03-2025 (Audited



